

RAN-2501001206010701

B.A. (Semester-VI) Examination March - 2026
Economics Paper-20 Major (NCF-NEP) (New)
Macro Economics

Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book	Seat No.: Student's Signature
---	--

- પ્ર-1. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો. (ગમે તે પાંચ) 10**
- 1) પ્રશિષ્ટ અને આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે નાણાંની માંગ એટલે શું?
 - 2) ભારતમાં નાણાંનો પુરવઠો માપવા માટેના અભિગમો જણાવો.
 - 3) નાણાંનો આવક વેગ એટલે શું?
 - 4) ઉત્પાદનના નીચલા અને ઉપલા તબક્કાઓ એટલે શું?
 - 5) નકારાત્મક મૂડીરોકાણનો અર્થ આપો.
 - 6) વ્યાજના દર અને રોકડ પસંદગી વચ્ચે કેવો સંબંધ છે?
 - 7) નાણાંકીય નીતિના ગુણાત્મક સાધનો કયા કયા છે?
- પ્ર-2. હોટ્ટેનો વ્યાપારચક્રનો સિદ્ધાંત વિગતે સમજાવો. 13**
- અથવા**
- પ્ર-2. અ) નાણાંના પુરવઠાને અસર કરતાં પરિબળો. 07**
- બ) વ્યાપારચક્રના લક્ષણો. 06**
- પ્ર-3. વ્યાજના દરના ધિરાણ ભંડોળના સિદ્ધાંતની ટીકાત્મક ચર્ચો કરો. 13**
- અથવા**
- પ્ર-3. અ) નાણાંકીય નીતિ અને આર્થિક વિકાસ. 07**
- બ) વિકાસશીલ દેશોમાં રાજકોષીય નીતિની ભૂમિકા. 06**
- પ્ર-4. ટૂંકનોંધ લખો. (ગમે તે બે) 14**
- 1) વ્યાપારચક્રનું નિયંત્રણ.
 - 2) વ્યાજના દરનો પ્રશિષ્ટ સિદ્ધાંત.
 - 3) રોકડ પસંદગીના હેતુઓ.
 - 4) નાણાંકીય નીતિના હેતુઓ.

ENGLISH VERSION

- Q-1. Answer the following questions briefly. (Any five) 10**
- 1) What is the demand for money according to the classical and modern economists?
 - 2) State the approaches to measuring to money supply in India.
 - 3) What is the income velocity of money?
 - 4) What are the lower and higher stages of production?
 - 5) Define negative investment.
 - 6) What is the relationship between interest rates and cash preference?
 - 7) Which are the qualitative instruments of monetary policy?
- Q-2. Explain in detail the trade cycle theory of Hawtrey. 13**
- OR**
- Q-2. A) Factors affecting the money supply. 07**
B) Characteristics of the trade cycle. 06
- Q-3. Critically discuss the loanable fund theory of interest rate. 13**
- OR**
- Q-3. A) Monetary policy and economic development. 07**
B) Role of fiscal policy in developing countries. 06
- Q-2. Write short note. (Any two) 14**
- 1) Control of trade cycle
 - 2) Classic theory of interest rate
 - 3) Objectives of liquidity preference
 - 4) Objectives of monetary policy
-